

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટન ઓન્ટેરિયોમાં ઇલેક્ટ્રિક-ઊર્જા સંચાલિત ફાયર ટ્રકનો ઉપયોગ કરનાર પહેલી મ્યુનિસિપાલિટી બનશે

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જૂન 16, 2021) – આજરોજ, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે બ્રેમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ફ્રન્ટ-લાઈન પંપરને (pumper) એક સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક-ઊર્જા સંચાલિત ફાયર ટ્રક, રોઝનબૌર આર.ટી. (Rosenbauer RT) વડે બદલવાની યોજનાઓને મંજૂરી આપી.

બ્રેમ્પટન એક હરિયાળુ શહેર છે, અને સ્થિરતા સુધારવા અને પર્યાવરણલક્ષી નવીન શોધમાં અગ્રેસર બનવા સમર્પિત છે. રોઝનબૌર આર.ટી. બજારમાં ઉપલબ્ધ થનારી પહેલી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક-ઊર્જા સંચાલિત ફાયર ટ્રક છે જે હાલના અગ્નિશમન ધોરણોને સંતોષી શકે છે. બ્રેમ્પટન ઇલેક્ટ્રિક-ઊર્જા સંચાલિત ફ્રન્ટ-લાઈન ઇમરજન્સી રિસ્પોન્સ વેલિકલનો ઉપયોગ કરનાર ઓન્ટેરિયોમાં પહેલી મ્યુનિસિપાલિટી બનશે, અને બર્લિન, એમ્સ્ટરડેમ, દુબઈ, લોસ એન્જેલસ અને વાનકુવર જેવા અન્ય વર્લ્ડ ક્લાસ શહેરોમાં જોડાશે.

ટ્રકની ટેકનોલોજી બ્રેમ્પટન ફાયરના કર્મચારીઓને કટોકટીની સ્થિતિમાં પ્રતિક્રિયા કરતી વખતે શૂન્ય ઉત્સર્જન ઉત્પન્ન કરવા દેશે, ન કેવળ પ્રવાસ દરમિયાન, પણ સ્થળ પર હો ત્યારે પણ. સ્થળ પર ઉત્સર્જન નાબૂદ થવાથી કાર્સિનોજેન્સ શ્વાસમાં લેવાનું ઘટવાને લીધે પર્યાવરણ અને સ્થળ પર હાજર ફાયરફાઈટર્સનું આરોગ્ય અને સુરક્ષા, બંનેને સંરક્ષણ મળે છે.

સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વેલિકલની વધારાની લાક્ષણિકતાઓમાં પેસેન્જર બસની જેમ, સવાર થવા ઊંચાઈ વધારવાની અને ઘટાડવાની ક્ષમતાનો સમાવેશ થાય છે, જેનાથી વાહનમાં પ્રવેશવામાં સરળતા રહે છે. આ લાક્ષણિકતા ફાયરફાઈટર્સ સ્થળ પર હોય ત્યારે સાધન સુધી પહોંચવા માટે પહોંચની ઊંચાઈ પણ ઘટાડે છે. સવાર થવાની ઊંચાઈ 6.8 ઈંચ સુધી ઘટાડી શકાય છે અને 18.5 ઈંચ સુધી ઊંચાઈ વધારી શકાય છે, જેનાથી પૂર જેવા સંકટમાં પાણી એન્જિનમાં પ્રવેશવાની કોઈ તક રહેતી નથી. નવી ફાયર ટ્રકથી અગ્નિશમન કર્મચારીઓને નવા સબડિવિઝનસમાંના તંગ સ્થળોમાં અને સાંકડા રસ્તાઓ પર વધારે કાર્યક્ષમ રીતે ખસવામાં મદદ મળશે, અને અઘતન અર્ગોનોમિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જેનાથી ફાયરફાઈટર્સનું આરોગ્ય અને સુરક્ષા સુધરશે.

નવી ઇલેક્ટ્રિક ફાયર ટ્રકને હાલમાં બંધાઈ રહેલાં નવા, અઘતન બ્રેમ્પટન ફાયર કેમ્પસમાં રાખવાનું આયોજન છે. સીટીને ટ્રક 2022 નાં અંત પહેલાં મળશે.

બ્રેમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.bramptonfire.com. સીટીની કાઉન્સિલની અગ્રતાની પરિભાષા પર વધુ માહિતી મેળવવા માટે: બ્રેમ્પટન એક હરિયાળુ શહેર છે, વેબસાઈટ જુઓ, www.brampton.ca.

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટનમાં, અમે એક હરિયાળા શહેર તરીકે કરીએ છીએ તે બધાં કાર્યોમાં વધારેને વધારે કાયમી સમુદાયનું નિર્માણ કરવા કાર્યરત છીએ. હું ઓન્ટેરિયોની પહેલી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ફાયર ટ્રક સુરક્ષિત કરવાના બ્રેમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના પ્રયત્નો બદલ તેઓને અભિનંદન આપું છું. બ્રેમ્પટન એક વર્લ્ડ ક્લાસ શહેર છે, અને આપણાં સમુદાયોને સુરક્ષિત રાખતી વખતે આબોહવામાં ફેરફાર પ્રત્યે સ્થિતિસ્થાપકતા વધારવા અને ઉત્સર્જન ઘટાડવા કાર્યરત અન્ય લોકો સાથે જોડાવામાં અમે ગૌરવ અનુભવીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટન એક નવીન શહેર છે, અને અમે આપણી સ્થિરતા સુધારવા અને આપણાં રહેવાસીઓ અને કર્મચારીઓનું સંરક્ષણ કરવા હંમેશા નવી રીતો શોધતા રહીએ છીએ. નવી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ફાયર ટ્રકથી આપણી સમર્પિત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ટીમનું જોખમ ઘટશે અને તેઓનું આરોગ્ય અને સુરક્ષા સુધરશે, અને આપણાં સમુદાયમાં ઉત્સર્જન ઘટશે. બ્રમ્પટન ફાયર હરિયાળી ટેકનોલોજી અપનાવવામાં ટ્રેઇલ બ્લેઝર બનવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ.”

- રોવિના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ વતી, હું સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ફાયર ટ્રક, રોઝનબૌર આર.ટી. પર અમારો રોમાંચ વ્યક્ત કરવા ઇચ્છું છું. ટ્રકમાં સ્થળ પર કાર્સિનોજેન્સ ઘટાડવાથી માંડીને, અદ્યતન અર્ગોનોમિક ટેકનોલોજી જેવી, ઘણી રોમાંચક લાક્ષણિકતાઓ છે, અને પર્યાવરણલક્ષી સ્થિરતામાં અગ્રેસર બનવા અમને સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. અમે આપણાં સમુદાયનું સંરક્ષણ કરવા તેનો ઉપયોગ કરવા આશાવાદી છીએ.”

- બિલ બોયસ (Bill Boyes), ચીફ, બ્રમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ, સીટી ઓફ બ્રમ્પટન

“સીટી ઓફ બ્રમ્પટનના કર્મચારીઓ આપણાં સમગ્ર સંચાલનોમાં સ્થિરતા સુધારવા અને કાઉન્સિલની અગ્રતાની પરિભાષાને આગળ વધારવા સમર્પિત છે: બ્રમ્પટન એક હરિયાળુ શહેર છે. એક નવી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક ફાયર ટ્રક ઉપયોગમાં લઈને, બ્રમ્પટન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ઉત્સર્જન ઘટાડશે અને પર્યાવરણલક્ષી નવીન શોધમાં અગ્રણી તરીકે અન્ય વર્લ્ડ-ક્લાસ શહેરો સાથે જોડાશે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca